

C.U.SHAH UNIVERSITY

WADHWAN CITY

University (Winter) Examination -2013

Course Name : Diploma(Engineering)Sem-I

Subject Name: -Basic Electrical Engineering

Marks:70

Duration :- 2:30 Hours

Date : 8/1/2014

Instructions:-

- (1) Attempt all Questions of both sections in same answer book / Supplementary.
- (2) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
- (3) Instructions written on main answer Book are strictly to be obeyed.
- (4) Draw neat diagrams & figures (If necessary) at right places.
- (5) Assume suitable & Perfect data if needed.

SECTION-I**Q1.Do as directed**

(7)

- (a) Draw the symbols of resistor, capacitor, inductor and transformer.
- (b) Write the units of resistance, capacitance, inductance and resistivity.
- (c) Write first law of Electrostatics.
- (d) State Ohm's Law.
- (e) State two types of induced EMF.
- (f) State three factors affecting on resistance.
- (g) $1000nA = \underline{\hspace{2cm}} A$

Q2. (a) State and explain Faradays laws of Electromagnetic induction. (5)

(b). Define the following terms: (5)

- (1) Self Inductance
- (2) Mutual Inductance
- (3) Residual Flux density
- (4) Dynamically Induced EMF
- (5) Magnetic Field strength

(c) If we apply **100 V** to the resistor then **50 μ A** current is flowing through it.

Calculate the resistance of resistor (4)

OR

Q2/(a) Explain laws of resistance and derive necessary equation. (5)

(b) Define the following terms: (5)

- (1) Current
- (2) EMF
- (3) Potential difference
- (4) Resistance
- (5) Resistivity

(c) Calculate the resistance of **100 m** length of a wire having a uniform cross-sectional area of **0.001 m²** if the wire is made of manganin having a resistivity of **$50 \times 10^{-8} \Omega\text{-m}$** . (4)**1/4****8-14**

- Q3.(a) Derive the equation for capacitors in series and capacitors in parallel. (7)
(b). What is magnetic hysteresis? Explain magnetic Hysteresis loop with necessary diagrams. (7)

OR

- Q3.(a) Derive the equation for resistors in series and resistors in parallel (7)
(b) Explain Charging & Discharging of capacitor. (7)

SECTION-II

- Q4 .Do as directed** (7)

- (a) State maximum power transfer theorem.
- (b) Write the function of commutator in dc generator.
- (c) Write formula of capacitive reactance and inductive reactance.
- (d) Draw the waveform of voltage and resultant current when ac is applied to pure & alone resistor.
- (e) Write formula for resonance frequency for RLC series circuit.
- (f) What is the phase difference between each two phase in 3-phase ac system.
- (g) What is the time period of AC source in our house.

- Q5.(a) Explain with diagram generation of alternating EMF. (5)

- (b) Define the following terms: (5)

- (1) RMS value
- (2) Frequency
- (3) Active component of ac current
- (4) Power factor
- (5) Phase Difference

- (c) Explain resonance in RLC series circuit and derive equation for resonance frequency. (4)

OR

- Q5. (a) Explain the working and construction of MCB. (5)
(b) Explain working of single phase induction motor. (5)
(c) Explain pipe earthing with neat diagram . (4)

- Q6.(a) State & Explain Kirchoff's current Law & Kirchoff's Voltage Law. (7)
(b) Explain the principle and construction of DC generator with proper diagrams. (7)

2/4



OR

- Q6.(a) Explain construction and working principle of single phase transformer. (7)
 (b) Explain STAR & DELTA connections & give its line and phase Voltage & Current relationships (7)

GUJARATI VERSION

સેક્શન-1

પ્ર-1 માર્ગાણી લખો

(7)

- (એ) રેઝિસ્ટર, કેપેસીટર, ઈંડક્ટર અને ટ્રાંસફોર્મર ના સીખોલ દોરો.
- (બી) રેઝિસ્ટર, કેપેસીટર, ઈંડક્ટર અને રેઝિસ્ટરીવીટી ના એકમો લખો.
- (સી) ઈલેક્ટ્રોનાસ્ટેટીક્સ નો પ્રથમ નિયમ લખો.
- (ડી) ઓહસ નો નિયમ લખો.
- (ઇ) ઈંડ્યુસ્ટ્રિયુનિવર્સિટી ના બે પ્રકાર લખો.
- (એફ) રેઝિસ્ટર પર અસર કરતા ત્રણ પરીબળો ના નામ લખો.
- (જ) $1000\text{nA} = \underline{\hspace{2cm}}\text{A}$



- પ્ર-2 (એ) ઈલેક્ટ્રોમેગનેટીક્સ ઈન્ડક્સના નિયમો લખો અને સમજાવો. (5)
 (બી) નિયેના પદોની વિષયા આપો. (5)
- (1) સેલ્ફ ઈન્ડક્ટસ
 - (2) મુચ્યલ ઈન્ડક્ટસ
 - (3) રેસીલ્યુઅલ ફલક્સ ડેન્સિટી
 - (4) ડાયનેમીકલી ઈંડ્યુસ્ટ્રિયુનિવર્સિટી ઈંડ્યુસ્ટ્રિ ઈંડ્યુસ્ટ્રી
 - (5) મેગનેટિક ફિલ સટ્રેંથ
- (સી) જો **100 V** એક રેઝિસ્ટર ને આપવામાં આવે તો **50 μA** કર્ણ ફલો થાય છે તો રેઝિસ્ટરના રેઝિસ્ટર ની કીમત શોધો. (4)

અથવા

- પ્ર-2 (એ) રેઝિસ્ટર ના નીયમો જરૂરી સમીક્ષા દારા સમજાવો. (5)
 (બી) નિયેના પદોની વિષયા આપો. (5)
- (1) કર્ણ
 - (2) ઈંડ્રેમેન્ટ
 - (3) પોટેન્સીયલ ડીફરન્સ
 - (4) રેઝિસ્ટર
 - (5) રેઝિસ્ટરીવીટી
- (સી) મેંગેનીનમાં થી બનાવેલ **100 m** લાંબા અને **0.001 m²** આડહેદ સેન્ટ્રેફળ વાળા વાયરના રેઝિસ્ટરની કીમત શોધો જો તેની રેઝિસ્ટરીવીટી **$50 \times 10^{-8} \Omega\text{-m}$** હોય. (4)



- પ્ર-3(એ) કેપેસીટર ને સીરીજ અને પેરેલલ જોડવામાં આવે તો તેના સુત્ર મેળવો. (7)
 (બી) મેઝનેટિક હિસ્ટેરેસીસ શુ છે આકૃતી ની મદદથી હિસ્ટેરેસીસ લૂપ સમજાવો. (7)

અથવા

- પ્ર-3(એ) રેઝિસ્ટરસ ને સીરીજ અને પેરેલલ જોડવામાં આવે તો તેન સુત્ર મેળવો. (7)
 (બી) કેપેસીટર નુ ચાર્જગ અને ડિસ્ચાર્જગ સમજાવો (7)

સેક્ષન-2

- પ્ર-4 માર્ગ્યા પ્રમાણે લખો (7)

- (એ) મેક્સીમમ પાવર ટ્રાંસફર થીયરમ લખો
 (બી) વીસી જનરેટર માં કોમ્પ્યુટેર નુ કાર્ય લખો.
 (ગી) કેપેસીટીવ રીએક્ટેસ અને ઈન્ડક્ટીવ રીએક્ટેસ ના સુત્ર લખો.
 (ડી) શુધ અને એકલા રેઝિસ્ટરને એસી વોલ્ટેજ આપવામાં આવે તો વોલ્ટેજ અને પરીક્ષામી કરંટ નુ વેવફોર્મ દોરો.
 (ઈ) આર.એલ સી સરકીટ માટે રીજોનન્સ ફીકવંસી નુ સુત્ર લખો.
 (એફ) 3-ફેઝ એસી સીસ્ટમ માં બે ફેઝ વચ્ચે કેટલો ફેઝ ડિફરન્સ હોય છે.

- (જી) આપણા ઘરમાં આવતા એસી સોર્સ નો ટાઇમ પીરીયડ કેટલો હોય છે.
 પ્ર-5(એ) આકૃતી દ્વારા ઓફર્ન્ટીગ ઈએમએફ નુ જનરેશન સમજાવો. (5)

(બી) નિયેના પદોની વચ્ચા આપો. (5)

- (1) આર.એમ.એસ વેલ્યુ
- (2) ફીકવંસી
- (3) એકટીવ કોમ્પોનન્ટ ઓફ એસી કરંટ
- (4) પાવર ફેક્ટર
- (5) ફેઝ ડિફરન્સ

(સી) આર.એલ.સી સીરીજ સર્કીટ માટે રીજોનન્સ સમજાવો અને રીજોનન્સ ફીકવંસી નુ સુત્ર મેળવો. (4)

અથવા

- પ્ર-5(અ) એમ.સી..બી ની રચના અને કાર્ય સમજાવો. (5)

(બી) સીગલ ફેઝ ઈન્ડક્ષન મોટરનુ વરકીગ સમજાવો. (5)

(સી) ખાલી આકૃતી થી પાઈપ અર્થીગ સમજાવો. (4)

- પ્ર-6 (એ) કેસીએલ અને કેવીએલ ના નીયમો લખો અને સમજાવો. (7)

(બી) વીસી જનરેટર નો સિંધ્યાત અને રચના આક્રિતી ની મદદથી સમજાવો. (7)

અથવા

- પ્ર-6(એ) સીગલ ફેઝ ટ્રાંસફોર્મર ની રચના અને કાર્ય સમજાવો. (7)

(બી) સ્ટાર અને તેલ્ટા કનેક્શન સમજાવો અને તેમાં ફેઝ અને લાઈન વોલ્ટેજ/કરંટના સંબંધો લખો. (7)

*****8****14****

